



# 5 બાબતો કે જેના વિષે તમારે જાણવું જોઈએ ભેદભાવ વિરુદ્ધના કાયદા હેઠળ શાળામાં ભેદભાવ અને પજવણી સામે રક્ષણ

- 1 ન્યુ જર્સી લો અગેસ્ટ ડિસ્ક્રિમિનેશન (એલએડી), રોજગાર, આવાસો અને જાહેર આવાસોના સ્થળોએ ભેદભાવ અને પૂર્વગ્રહ આધારિત પજવણી ઉપર મનાઈ ફરમાવે છે, જેમાં શાળાઓનો પણ સમાવેશ થાય છે, કે જે વાસ્તવિક અથવા માનવામાં આવતી જાતિ, ધર્મ, રાષ્ટ્રીય મૂળ, લિંગ, જાતીય સંલગ્નતા, અપંગતા, લિંગના આધારે ઓળખ અથવા અભિવ્યક્તિ અને અન્ય સુરક્ષિત લાક્ષણિકતાઓને આધારે કરવામાં આવતી હોય. આનો અર્થ એ છે કે તમે વિદ્યાર્થીઓ અથવા શાળાના કર્મચારીઓ દ્વારા તંગાદિલીભર્યું શાળા વાતાવરણ બનાવે તે રીતે પૂર્વગ્રહ આધારિત પજવણીનો ભોગ બની શકશો નહીં.
- 2 જો કોઈ શાળા આ પ્રકારની પજવણી વિશે જાણે છે અથવા જાણ હોવી જોઈએ, તો તેને રોકવા માટે પગલાં ભરવા જ જોઈએ. દાખલા તરીકે, જો કોઈ શિક્ષક અથવા અન્ય શાળાના અધિકારી જાણે છે કે એક વિદ્યાર્થી તેની અપંગતાને કારણે સહાયતાથી દ્વારા વારંવાર પજવણી કરે છે, તો શાળાએ કાર્યવાહી કરવી આવશ્યક છે.
- 3 એલએડી શાળા-પ્રાયોજિત કાર્યો અને પ્રવૃત્તિઓ પર પણ લાગુ પડે છે જે શાળાના સમય ઉપરાંત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થીઓને સાથી ખેલાડીઓ, વિરોધીઓ અથવા ચાહકો દ્વારા જાતિગત અથવા ધાર્મિક પરેશાની કર્યા સિવાય હાઈસ્કૂલ અને કોલેજ એથલેટિક્સમાં ભાગ લેવાનો અધિકાર છે.
- 4 એલએડી જાતિ, ધર્મ, લિંગ, જાતીય અભિગમના આધારે શાળાની શિસ્ત નીતિઓના અમલીકરણમાં અન્ય સુરક્ષિત લાક્ષણિકતાઓના આધારે ભેદભાવ કરવામાં, અને સસ્પેન્શન અને હકાલપટ્ટી સહિતના ભેદભાવને પણ પ્રતિબંધિત કરે છે.
- 5 પૂર્વગ્રહ આધારિત પજવણી અથવા ભેદભાવની જાણ કરવા માટે, એલએડી હેઠળ આ અથવા અન્ય કોઈપણ અધિકારનો ઉપયોગ કરવા અથવા અમલ કરવાનો પ્રયાસ કરવા બદલ અથવા કોઈ બીજા હકનો ઉપયોગ કરવામાં મદદ કરવા બદલ કોઈશાળા કોઈ વ્યક્તિ વિરુદ્ધ પગલા લઈ શકશે નહીં.

વધુ જાણવા માટે અથવા ફરિયાદ નોંધાવવા માટે, [NJCivilRights.gov](http://NJCivilRights.gov) પર જાઓ અથવા 973-648-2700 પર કોલ કરો



એટર્ની જનરલની એન.જે. ઓફિસ  
[NJCivilRights.gov](http://NJCivilRights.gov)

DIVISION ON  
**CIVIL RIGHTS**